

SE/LODR/AGM/1/FY2017-18 September 4, 2018

To

 The Manager, Corporate Relationship Dept., BSE LIMITED, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, MUMBAI – 400 001

Script Code: 526725

#### E-FILING

 The Manager, Listing Department, NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD., "Exchange Plaza", C-1, Block-"G", Bandra-Kurla Complex, Bandra (E), MUMBAI – 400 051

NSE Symbol: SANDESH (EQ.)

Dear Sir / Madam,

Sub: Intimation to Stock Exchange regarding publication in Newspapers for:

- a. Notice of 75th Annual General Meeting of the Company
- b. Information regarding remote e-voting information

Pursuant to Regulation 30 and 47(3) read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copies of newspaper advertisements published in Indian Express (English) and Sandesh (Gujarati), regarding:

- 1. The Notice convening 75th Annual General Meeting (AGM) of the Company to be held on Friday, September 28, 2018, at 10:00 A.M. at Gujarat Law Society Auditorium, G.L.S. College Campus, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006; and
- 2. The information regarding remote e-voting information (including Closure of Register of Members and Share Transfer book of the Company), for the aforesaid AGM.

Further, the copies of the said advertisements are also available on the website of the Company (www.sandesh.com).

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,

FOR, THE SANDESH LIMITED

DHAVAL PANDYA COMPANY SECRETARY

Encl: As Above



VISIT US: WWW.SANDESH.COM

# GUJARAT

# 3, including 2 GUJCOT officers, booked in jute bag fire case

**EXPRESS NEWS SERVICE** RAJKOT, SEPTEMBER 1

AROUND FIVE months after 25 lakh empty jute bags caught fire on sub-yard of agriculture produce market committee (APMC), the 'B' Division police station in the city on Friday booked two top officers of GUJCOT and another man, accusing them of being part of a criminal conspiracy to set the stock on fire to cover up their malpractices in their purchase. The FIR comes two days after

the Regional Forensic Science Laboratory in Rajkot concluded that the fire was intentional.

'B' Division police inspector Rakesh Thakar gave a complaint to 'B' police station late on Friday night. In his complaint, Thakar named Manoj Brahmbhatt, general manager (operations) of GU-JCOT (Gujarat State Cooperative Cotton Federation Limited), Magan Zalavadiya, GUJCOT warehousing manager for Saurashtra zone), and Paresh Shankharva, an aide of Zalavadiya. This is the second FIR lodged in connection with the incident in which the jute bag stock had caught fire on March 13. This is also third case in which Zalavadiya has been booked.

After the jute bag stock had caught fire, the 'B' division police of Rajkot city had registered a noncognisable offence and initiated a primary enquiry. Experts of FSL, Rajkot, had also joined the enquiry

and they submitted their report to the city police on August 28.

Based on Thakar's complaint, the trio have been booked under IPC sections 407 (criminal breach of trust by carriers etc), 409 (criminal breach of trust by public servant, or by banker, merchant or agent), 420 (cheating and dishonestly inducing delivery of property), 435 (mischief by fire or explosive substance), 465 (punishment for forgery), 468 (forgery for purpose of cheating), 285 (negligent conduct with respect to fire or combustible matter) and 120-B (criminal conspiracy). The fire had also caused damage to two sheds of the APMC and therefore the trio have been booked under the Damage to Public Property Act.

"Based on videos and photographs of the incident of fire on the jute bags stored at the APMC godown in Rajkot on March 13, forensic science officers have concluded that prima facie there were actually around 15 lakh bags instead of around 19.5 lakh bags, which should have been there as per official records. Additionally, Manoj Brahmbhatt has made personal financial gains in the purchase of these jute bags and therefore, he will be arrested," commissioner of police (CP) of Rajkot city, Manoj Agrawal told media persons.

Agrawal said that the offence was revealed during investigation of a case registered on August 19 allegedly sold off 34,500 jute bags without following the due procedure and pocketed proceeds from it. These three truck loads of bags were salvaged from the stock, which had caught fire on the Rajkot APMC godown. 'B' Division police had booked Zalavadiya, a GUJCOT officer named Manoj, four aides and relatives of Zalavadiya and two traders for criminal conspiracy, forgery, criminal breach of trust, cheating and destruction of evidence etc. Police had arrested Zalavadiya and seven others and all of them are in judicial custody at present. While investigating the case of unauthorised sale of bags, 'B' division police

after Zalavadiya and seven others

Brahmbhatt, general manager (purchase) manager Manoj Vyas etc. While questioning Brahmbhatt and other officers in the case of unauthorised sale, police stumbled upon the case of alleged irregularities in purchase of the bags and the conspiracy to set the stock on fire at Rajkot APMC. In his complaint, Thakar stated that while reviewing tendering documents, it was found that

Brahmbhatt had not followed due

procedure while purchasing these

bags from eight private firms and

had received kickbacks. KL Jute,

Kolkata; Veer International,

Kolkata, and Shantinath

Packaging, Anand paid Rs 16 lakh,

had questioned top GUJCOT offi-

cers, including its managing direc-

tor Narmadashankar Sharma,

Rs 11 lakh and Rs 4 lakh, respectively, to Brahmbhatt for securing contracts of supplying bags to GU-ICOT. The money was routed to bank accounts of Brahmhbatt, his wife Kavita and daughter Niyati through other firms, Thakar, who is investigating officer of the case of unauthorised sale of bags, stated in his complaint.

The complaint also stated that there were discrepancies in the GUJCOT records of delivery of bags at the Rajkot APMC sub-yard and actual presence of truck ferrying the stocks to the yard as established by location of mobile phones of truck drivers. "Not only this, a local surveyor of New India Assurance company submitted a report to the effect that the fire in the jute bag stock could be due to human intervention and that the local GUJCOT officers had not taken appropriate measures for safe storage of bags. The New India Assurance company had rejected the insurance claim of GUJCOT for the damaged jute bags. However, Brahmbhatt got GUJCOT to transfer Rs 25 lakh each in two bank accounts of four individuals who, subsequently returned the money to Brahmbhatt in cash. Brahmbhatt couriered Rs 50 lakh cash to one M K Tully, who lives in Delhi, as commission to have the refusal by the New India Assurance to positively settle GUJCOT claim for fire at Rajkot APMC yard reversed," Thakar told *The Sunday* 

# Rajkot police

Raikot: To ensure that people with criminal antecedents do not create any disturbance, Rajkot city police has decided to use Israeli surveillance technology, which identifies individuals on the basis of their facial lines and voice spectrum at Goras fair, which began in

Rajkot city police commissioner Manoj Agrawal said that two experts from Israel, one from Canada and three from India will wear small devices on their clothes and mingle with revellers at the fair. These devices will identify people with criminal records based on data fed to a system. These sensors will then send alerts to a police control-

Contact Person

Mr. Divyang Shah Mob: 9925755122



residence in Ahmedabad on Saturday. Twitter

**DAY 8 OF INDEFINITE FAST** 

Saturday, his supporters forced activist Medha Patkar to return without meeting him, claiming her agitation against the Narmada dam project was seen as "anti-farmer". Hardik has been on an indefinite fast at his house on the outskirts of the city since August 25 to press for the demand of reservation for the Patidar community and a loan waiver for farmers in the state.

Narmada Bachao Andolan leader Patkar on Saturday arrived at Hardik's house to meet him. However, workers of the Patidar Anamat Andolan Samiti (or PAAS, which Hardik leads) did not allow her to meet him.

A press release from PAAS put out by spokesperson Brijesh Patel said: "Medha Patkar's position has, from the beginning, been anti-Narmada, which delayed the Sardar Sarovar Project (SSP) and thus the farmers of Gujarat were deprived of Narmada water for a long time".

Patkar told The Sunday Express that she had gone with two Gandhians "one was 83 and

Ahmedabad: Chief Minister Vijay

Rupani has handed over the port-

folios of his deputy Nitin Patel to

two cabinet ministers. Patel left

for Japan for an eight-day tour on

Saturday. Patel's portfolios of

Dy CM's portfolios given to 2 ministers have been allotted to energy minister Saurabh Patel, while the portfolios of Roads and Buildings,

Narmada, Kalpasar and capital

projects have been allotted to ed-

ucation minister Bhupendra

Chudasma, according to an offi-

another 93 years old", but were have proper understanding of the Narmada dam issue...we are stopped. "I am not sure if Hardik was even told that we had come raising voice in favour of farmers. But those who do not know this...(are opposing me). Thous-

Friday some supporters of Hardik had called her and said that he had stopped taking water. "I told them that he should not, because that would cause irreversible damage. So they handed over the phone to him and I told him that I would come tomorrow (Saturday)". She said that when she reac-

State Congress president Amit Chavda meets Patidar quota leader Hardik Patel at his

PAAS workers stop Medha Patkar from

meeting Hardik, say she is anti-farmer

hed, some people stopped her and apologised for not letting her meet him. "They folded their hands and asked me to return, even as some commotion erupted from behind, which I feel was instigated." She added that when she sat on a dharna in Kevadiya, "Hardik had once come to see me."

PAAS claimed in its statement that Patkar's claim that she was invited to come to the fast venue was "wrong". "Our core members never invited her," the statement said. The statement added that

they had "offered water to Patkar, made her sit down and requested her to leave".

Later, Patkar told media that she was not anti-farmer.

"Even today people do not

increased, leading to the infection, which is progressing.

## Patan BJP MP hit by cow, admitted in ICU

**EXPRESS NEWS SERVICE** AHMEDABAD, SEPTEMBER 1

BJP MP from Patan Liladhar Vaghela, 84, sustained multiple rib fractures when he was hit by a cow outside his house in

Gandhinagar on Thursday. According to his son Harshad, Vaghela was walking outside his house at the time of the incident.



Liladhar Vaghela

Speaking to The Sunday Express, Harshad said, "My father was walking outside our house around 3.30 pm on Thursday when a cow hit him and he fell. Two boys working in a laboratory nearby rushed to his help. My wife also joined them, and together they helped him on a chair. We then took him to Gandhinagar Civil hospital where the X-Ray showed multiple fractures in his ribs, so we shifted him to Apollo hospital."

In a statement issued on Friday, Apollo hospitals, Gandhinagar, said that Vaghela was brought in the evening of Thursday and was diagnosed with "multiple rib injuries". "In view of his existing comorbidities and age, he was admitted in ICU. Patient is currently stable," the statement read.

## **VIBRANT GUJARAT** State govt partners with US advocacy group

Washington: The state government has partnered with a top India-centric American advocacy group for the Vibrant Gujarat summit-2019, which is expected to be attended by some American

corporate leaders. John Chambers, chairman of US-India Strategic and Partnership Forum (USISPF), will lead a CEO delegation to the summit next year, a media release said here on Friday. **PTI** 

# 'Gujarat saw 50% jump in atrocity cases against SCs between 2010-17'

**AVINASH NAIR** AHMEDABAD, SEPTEMBER 1

THE STATE has witnessed a 50 per cent increase in the number of cases of atrocities against Scheduled Castes in the last eight years between 2010 and 2017, according to figures shared by Union Minister of State for Justice and **Empowerment Ramdas Athaw**ale on Friday.

The number of cases registered with the police about atrocities on Scheduled Castes under the Scheduled Caste and Scheduled Tribe (Prevention of Atrocities) Act 1989, shows that over 9,000 cases have been registered in Gujarat during the last eight years. This include cases of murder, grievous hurt, rape, arson and other offences.

In comparison to the 1,006



'Casteism is the reason for these atrocities'

cases of atrocities lodged in 2010, the number rose by over 50 per cent to 1,515 till the end of 2017. By the end of June 2018, an additional 795 cases were registered in the state. The figures, pertaining to only Scheduled Castes, show that the number of murders and rapes have more than doubled in eight years. These figures were shared at a meeting held at the circuit house here on Friday where the Union minister and state government officials were present. "I know that

atrocities were committed against

Dalits in Una (in 2016). Atrocities

are happening in other parts of the

country. Even when Congress was

in power, atrocities happened and it is continuing even when the BJP is in power. The government is not the reason for these atrocities. Casteism is...." Athawale said.

The figures show that Gujarat accounts for a little over three per cent of the cases of atrocities registered in the country in 2017. "Last year's figures show that there were 47,000 cases of atrocities (in the country) and if Gujarat's figures are taken into consideration then 1,515 cases

were registered in 2017," he said. On identifying pockets prone to caste conflicts in the state, Manoj Aggarwal, Principal Secretary of Department of Social Justice and Empowerment of the state government, said, "You may contact Director of Scheduled Castes Welfare KD Kapadia." Kapadia could not be reached despite repeated attempts.

# using Israeli surveillance at Goras fair

the city on Saturday. room. ENS

## Finance, Health and Family Welfare, and Technical Education

INDIAN INSTITUTE OF INFORMATION TECHNOLOGY PUNE

cial release. **ENS** 

A/P: Sadumbre, Talegaon - Chakan Road,

Tal: Maval, District: Pune - 412109

Applications are invited for the post of ASSISTANT PROFESSOR in Electrical Engineering on temporary basis and for a contract period of 11 months

Walk in interviews for the said post is scheduled on 18th September 2018 at 10 am in the Department of Mechanical Engg, College of Engineering Pune, Shivajinagar Pune - 411005. For details of educational qualifications, relevant experience, application format, remuneration and other details kindly visit www.coep.org.in / recruitments OR www.iiitp.ac.in.

IC Registrar, IIIT Pune



Atal Incubation Centre - GTU Innovation & Startup Center Gujarat Technological University (GTU) for its Atal Incubation Centre

Recruitment for

1. Head-Incubator (CEO or COO) 2. Incubation Manager - 01 Post The above position will be purely on Contract basis for the Project enure of Maximum 5 Years or till the incubator wants to continu based on performance of the candidate.

Interested and eligible candidates are requested to send their application in prescribed form with relevant documents to Registrar, Gujarat Technological University on or before 15-09-2018, 6 pm For Details please visit: https://www.gtu.ac.in/Recruitment.aspx

Dt: -08-2018 I/C Registrar No. INF/ABD/1095/2018-19

STATE PROJECT IMPLEMENTATION UNIT NATIONAL CYCLONE RISK MITIGATION PROJECT - PHASE II DEPARTMENT OF DISASTER MANAGEMENT & CIVIL DEFENCE GOVERNMENT OF WEST BENGAL

Tran Bhawan, 5th floor, 87 A, S.N. Banerjee Road, Kolkats -700 014, Ph. No. 033-2264-0275 Email id - sencrmp2@gmail.com Advt. No. 1745-DMCD-11017/99V10/2017 The Government of India has received financing in the amount of US\$ 270 million equivalent from the World Bank towards the cost of National Cyclone Risk Mitigation Project Phase-II and it intends to apply

the proceeds to payments for goods, works, related services and consulting services under this Project.

2. The Government of West Bengal is also recipient of the credit and the West Bengal State Project. Implementation Unit Department of Disaster Management & John Civil Defence Government of West Bengal is implementing the relevant component of the Project in West Bengal 3. State Project Implementation Unit, Department of Disaster Management & Total Defence. Government of west Bengal is inviting applications for the positions given in the table below. 4. The staff for this Project will be selected based on contract / co-terminus with the Project. However, the continuation will be subject to review. 5. Increment of salary during this period will be completely based on involvement in the project, performance and output SI. No. No. of Post Salary in Rs./Month ₹40.000.00 Training Specialist

Training Assistant Of (One) General Conditions: 1. Details on Qualification and Scope and Nature of work for the Posts mentioned above will be available on the websitewbond.gov.in2. In all cases, experience in any World Bank assisted / International Agency funded project / Project preparation cell will be preferred. 3. Persons working in Government / Public Sector Undertakings / Autonomous Organisations should submit their applications through proper channel. 4. Candidates will have to produce the proof of details furnished in their applications, in general, as and when required. 5. Applications received after the due date. uraigned applications, applications without mentioning the post for which applied, applications not submitted with the copy of all supporting documents (wherever applicable) and applications incomplete in any respect, will not be considered. 6. Only Indian Nationals are eligible to apply. 7. Canvassing in

ICA-1842(2)/2018

any form will be a disqualification. S. it may be noted that if, at any stage, it is discovered that an attempt has been made by the applicant to wifully concest or misrepresent the fact, his I her candidature will be summarily rejected of his / her employment will be terminated. 9. The applications must be sent in neatly hand written or typed out A4 size paper. 10. Interested qualified persons may send applications. to the above mentioned address within \$1.10.18 upto 17.30 hrs. Principal Secretary Disaster Management & Civil Defence & Project Director SP(U,NCRMP-II)



ands of Patidar farmers are fight-

ing along with us because they

have not got the full rehabilita-

tion package," the environmen-

Meanwhile, state Congress

president Amit Chavda met

Hardik. "Gujarat is the land of

Mahatma Gandhi and Sardar

Patel. Even the British could not

suppress people's voice, so the

BJP has no capability to do that,"

Independent MLA Jignesh

Mevani tweeted: "Today Hardik

Patel's indefinite fast enters the

eighth day. He even gave up wa-

ter two days ago. He has put his

life at risk. This time it is not only

reservation for Patidars but also

farm loan waiver. I salute this

24-year-old youth leader's spirit.

The government should conduct

health bulletin, stating that

Hardik's kidneys got infected.

The bulletin also said that the

acetone content in his body had

Meanwhile, PAAS put out a

table talks today itself."

Extending support to Hardik's indefinite fast,

Chavda told reporters.

tal activist said.

### THE SANDESH LIMITED CIN-L22121GJ1943PLC000183

Registered Office: "SANDESH BHAVAN", Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054 (Gujarat-India) • Phone No.:- (079) 40004000 Email: investorsgrievance@sandesh.com and cs@sandesh.com

NOTICE FOR 75TH ANNUAL GENERAL MEETING,

REMOTE E-VOTING INFORMATION NOTICE is hereby given that 75th Annual General Meeting (AGM) of The Sandesh Limited (Company), will be held on Friday, September 28, 2018, at

Law Garden, Ellisbridge, Ahmedabad-380006, to transact the businesses as set forth in the Notice convening the AGM Annual Report of the Company for the FY 2017-18, including the Notice convening the AGM, has been sent electronically to those members who have registered their email IDs either with the Company or its Registrar & Share Transfer Agent or with the Depository Participants. Further the Notice convening the AGM together with Annual Report of the Company for FY 2017 18 has been dispatched to all other members (whose email ids are no

10:00 A.M. at Gujarat Law Society Auditorium, G.L.S. College Campus, Opp.

registered) at their registered addresses by permitted mode. Annual Report of the Company for the FY 2017-18, including the Notice convening the AGM is available on Company's website www.sandesh.com. The notice convening the AGM is also available on the website of Central Depository Services (India) Limited (CDSL) www.evotingindia.com. The dispatch of Annual Report for the FY 2017-18 inter alia, including the Notice convening the AGM to the members was completed on August 31, 2018. Any

such member who wishes to have a physical copy of Annual Report may write to the Company and the same would be provided at free of cost. Further, any member, who has not received Annual Report or any investor who has become a member of the Company after dispatch of Annual Report, may send a request to the Secretarial Department of the Company at 'Sandesh Bhavan', Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054 or email us at: investorsgrievancegsandesh.com / cs@sandesh.com for a copy of Annual Report and can also attend AGM in person or appoint a proxy. Notice is also given that pursuant to section 91 of the Companies Act 2013, read

with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Friday, September 21, 2018 to Friday, September 28, 2018 (both days inclusive), for the purpose of AGM.

Pursuant to applicable provisions of section 108 of the Companies Act 2013 read with Rule 20 of the Companies (Management and Administration) 2014. as amended from time to time and Regulation 44 of Listing Regulations, the Company has made necessary arrangements with CDSL to facilitate the Members to cast their votes on all the resolutions set forth in the Notice convening AGM, by electronic means, from a place other than venue of AGM ('remote e-voting') and the business may be transacted through such voting The facility for voting shall also be made available at AGM through polling paper and Members attending AGM who have not casted their votes by remote evoting shall be able to exercise their right at AGM. Please note that remote e-

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories, as on the cut-off date i.e. September 21, 2018 shall be entitled to avail the facility of remote e-voting or voting at AGM through ballot paper. Persons who are not the Members of the Company as on the cut-off date should treat this Notice for information purpose

Eligible Members who have acquired shares after the dispatch of Annual Report and holding shares as on the cut-off date may approach the Company for issuance of the USER ID and Password for exercising their right to vote by

Remote e-voting period begins at 09:00 A.M. on Tuesday, September 25, 2018 and ends at 05:00 P.M. on Thursday, September 27, 2018. During this period, the Members of the Company, holding shares either in physical form or in

dematerialized form, as on the cut-off date i.e. September 21, 2018 may cast their vote by remote e-voting. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Members who have casted their vote by remote e-voting prior to AGM may also attend AGM, but shall not be entitled to cast their vote again. A Member can opt

for only one mode of voting i.e. either through remote e-voting or voting at AGM. If a Member casts votes by both modes, then voting done through remote e-In case you have any queries or issues regarding remote e-voting, you may

refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com. Contact details: Mr. Rakesh Dalvi: Designation: Manager; Address: A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai 400013; Phone number: 18002005533.

By The Order Of The Board Of Directors, Date: September 1, 2018 For, The Sandesh Limited Place: Ahmedabad Dhaval Pandya Company Secretary

Ahmedabad

## 2 arrested with 5 kg cannabis

Jamnagar: The Narcotic Control Bureau (NCB) and Jamnagar police's Crime Branch arrested two persons and seized five kg of charas (cannabis) worth Rs 50 lakh in the international market, police said on Saturday.


Acting on a tip-off, the police nabbed Arun Manjare near Subhash vegetable market here and a receiver identified as Mamad Ali Mandalia, the Ahmedabad zonal unit of NCB said in a statement.

"Acting on a tip-off, the city LCB(Local Crime Branch) and NCB officials held Arun Manjare, who hails from Pune in Maharashtra. He was in possession of five km of charas worth around Rs 50 lakh in the international market," the statement said. **PTI** 

## WESTERN RAILWAY

LAYING AND LINKING OF BG Dy. Chief Engineer (Construction) Western Railway, Pratapnagar Vadodara-390004, invites E-Tender No. Dy.CE/C/I/BRC/DB-CDD-KEW/18 as per the details given below: Name of Work: Laying and linking of BG for Main & loop lines including points & crossing at various yards, spreading of ballast, tamping of track, dismantling of existing BG line and points & Crossing in yard and other incidental miscellaneous works between Dabhoi to Chandod Km. 0/00 to 18/200 (including Yards) in connection with "Gauge Conversion of existing NG track to BG track between Dabhoi-Chandod and extension upto Kewadiya (49.75 Km). Approximate Cost of Work: ₹ 273.48 lakhs. Earnest Money: ₹ 2,86,750/-. Availability of Online Tender for Bidding: From 07,09.2018 at 11.00 hrs. To 21.09.2018 upto 15.00 hrs. Date & Time of Opening: 21.09.2018 at 15.30 hrs. Regarding detailed notice containing cost of tender document (non refundable). EMD, eligibility criteria, Similar Nature of work, detailed tender conditions, please visit www.ireps.gov.in Manual offers will not

be considered. follows us on: ✓ twitter.com/WesternRly 🎖



Cosmos Bank Bhavan, Opp. Sales India, Income Tax Char Rasta, Ashram Road, Ahmedabad-380 009 Tel 079 27545693-94

**Gujarat Regional Office** 

Surat Branch Office UG/2, Meridian Tower, Near Apple Hospital, Udhana Darwaja, SURAT - 395002 Tel: 0261 2365449 / 2365935

## **TENDER NOTICE / AUCTION**

Bank has initiated recovery action against the following defaulted borrowers, the Authorized Officer of The Cosmos Co-op. Bank Ltd; appointed under The Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and rule made there under, had issued a demand notice on 18/11/2016, under section 13(2) of the said Act. The borrowers have not repaid the amount mentioned in the said notice within the stipulated time, hence the Circle Officer, Surat had taken the possession of the properly mentioned below under Section 13(4) of the said Act on 26/04/2018 and handed over the same to the Authorized Officer of the Bank. , the undersigned as the Authorized Officer of the Cosmos Co-op. Bank Ltd; in exercise of powers under the said Act, decided to sale the following mentioned property by inviting tenders / offers in sealed cover. Particulars is as under:

Name of the Borrower Company, Directors & Guarantors :- M/s. Viraj Corporation Pvt. Ltd. at Shop No 21, 2nd Floor, Sheetal Shopping Square, Majura Fire Station, Bhattar Road, SURAT Directors & Guarantors: Mr. Satishbhai Gopalbhai Patel & Mrs. Harshita Satishbhai Dudhat Guarantors : (1) Mr. Kanani Mukeshbhai Manubhai (2) Mr. Ambaliya Shaileshkumar Labhubhai

Description of Property in the Name of Mr. Satishbhai Gopalbhai Patel : All right title and interest in Shop no.21 admeasuring about 2642.00 sq. fts equivalent to 228.72 sq. mtrs and its carpet area admeasuring 1600.00 sq.fts equivalent to 148.64 sq. mtrs on 2 nd floor of Sheetal Shopping Square constructed on the land bearing sub plot no. 1 to 12 admeasuring about 4598.6514 sq.mtrs of Rev.S.No.93/1 & 98/1, City S.Nondh No.148/B, 159/B, 160/A, & 161 T.P. Scheme No.9 (Majura) final Plot No. 156/A of Village Majura, Ta. Choryasi Dist. Surat. threreon.

Property Inspection Reserve Price Earnest Money Deposit Auction/Sale Shop No.21 15-09-2018 20-09-2018 Rs. 15,51,000.00 Rs. 1,55,11,000.00 Time: 11.00 am to 3:00 pm Time: 12.00 noon Place of Auction : The Cosmos Co-op, Bank Ltd.,

TERMS AND CONDITIONS (1). The above property shall be sold on: "as is where is basis and is what is basis" (2). After opening of the sealed tenders, the tenderers / offerers may be given an opportunity to enhance the offer price. However, all rights will be reserved with Authorized Officer. The subject sale shall be confirmed in favor of the highest bidder. (3). The aforesaid property shall not be sold below the reserve price mentioned above. (4). Intending tenderers are required to deposit the EMD stated above by way of Pay Order / Demand Draft, payable at SURAT favoring "The Cosmos Co-op. Bank Ltd; Bidder has also to submit copy of Pan Card and address proof alongwith EMD. (5). The EMD will not carry any interest. (6). The said deposit shall be adjusted in the case of successful tenderer/bidder, otherwise refunded on the date of opening the tenders itself. (7). The tender amount along with the aforesaid EMD should be made in a sealed cover super scribed " Offer for the purchase of immovable property so as to reach at Office of the Authorized Officer The Cosmos Co-op. Bank Ltd; Surat Branch on or before 20/09/2018 before 11:00 am. Bids / Offers so received by the undersigned will be opened and considered on 20/09/2018 at The Cosmos Co-Op. Bank. Ltd., Surat Branch at 12:00 noon. (8). The successful bidder / offerer shall deposit 25% of the amount of the safe price, adjusting the EMD within one day. falling which the EMD shall be forfeited. (9). The balance 75% amount of sale price shall be payable on or before 15th day of confirmation of the sale by the Authorized Officer. In case of failure to deposit this balance amount within prescribed period, the 25% amount deposited shall be forfeited. (10) The Authorized Officer has absolute right to accept or reject any or all tenders offers or adjourn, postpone, cancel the Auction without assigning any reason thereof. (11) The Successful purchaser would bear the charges, fees , taxes, double stamp duty, registration fees etc. as applicable as per Law. (12) The Authorized Officer does hereby state that, to the knowledge of the Authorized Officer the said property is free from encumbrance. However, the successful tenderer shall ensure

by his own sources to find out any charge, lien, encumbrance, property tax, government dues in respect of the property shall be the

responsibility of the tenderers. This publication is also 15 days notice to all the Borrower / Guarantors / Mortgagers etc.

Date: 01-09-2018 Place: Surat

Surat Branch: UG/2, Meridian Tower, Nr. Apple Hospital, Udhana Darwaja,

SURAT - 395002 Tel: 0261 2365449 / 2365935

**Authorised Officer** The Cosmos Co-Op Bank Ltd., - Gujarat Regional Office **•** 

## **SANDESH**

ધી યુનાઈટેડ કો.ઓપરેટીવ બેંક લી. અમદાવાદ મણીભદ્ર એવન્થુ, શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રીજ પાસે, વેજલપુર, અમદાવાદ–૩૮૦૦૧૫.

#### नोटीस

આથી બેંકના તમામ સભાસદ ભાઈ-બહેનોને જણાવવાનું કે આપણી બેંકની સને ૨૦૧૭–૨૦૧૮ની વાર્ષિક સાધારણ સભા તા. ૧૫–૦૯–૨૦૧૮ને શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે ધી અમદાવાદ મિલિટરી એન્ડ રાયફલ ટ્રેનિંગ એસોશિએશન, ખાનપુર, અમદાવાદ–૩૮૦૦૦૧ ખાતે કાર્યસૂચીમાં દર્શાવેલ એજન્ડા મુજબના કામો માટે મળશે. તો તેમાં હાજરી આપવા વિનંતી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં આદેશથી

dl. 09-06-2096 ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર

નોંધ : બેંકના ૨૦૧૭–૨૦૧૮ના વાર્ષિક અહેવાલ, સરવૈયા, નફા–તોટા અંગેની માહિતી બેંકની હેડ ઓફિસનો સંપર્ક કરી મેળવી લેવા વિનંતી.

#### દ્યી વિસનગર નાગરિક સહકારી બેંક લી.(ફડચામાં)વિસનગર હેડઓફીસ, ગંજબજાર, વિસનગર

#### સુચના

આથી વિસનગર નાગરિક સહકારી બેંક લિ.,(ફડચામાં) વિસનગરના જે બાકીદારોએ રાજ્ય સરકાર દ્વારા ફડચા હેઠળની નાગરિક સહકારી બેંકો માટેની "ખાસ વન ટાઈન સેટલમેન્ટ યોજના ૨૦૧૭" અન્વયે યોજનાનો લાભ લેવા અરજી કરેલ હોય તેઓને આ યોજનાનો લાભ મંજુર કરવામાં આવેલ છે. જેનો લાભ મેળવવા માટેનો સમય તા.૩૦/ ૦૯/૨૦૧૮ના રોજ પુરો થનાર છે.

જેથી ઓ.ટી.એસ. યોજના નો લાભ મેળવેલ બાકીદારો એ યોજના મુજબનો લાભ લઈ ધીરાણ ભરપાઈ કરવાની મુદત તા.૩૦/૦૯/ ૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે. જેથી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કરાર આધારિત વ્યાજ સાથે સંપૂર્ણ રકમ વસુલ કરવામાં આવશે. જેની સર્વે બાકીદારોએ ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે સંબંધિત શાખાનો રૂબરૂ સંપર્ક કરવો.

(શ્રી પી.એસ.ઉપાધ્યાય) ફડયા અધિકારીશ્રી, દ્યી વિસનગર નાગરિક સહકારી બેંક લી,(ફડચામાં) તા.૦૧-૦૯-૨૦૧૮

## વિસનગર

એસ.એસ.જી.હેસ્પિટલ,વડોદરા દ્વારા ઓનલાઇન ટેન્ડર e-Tender 2018-19-20 "Total Joint Replacement Implants and Biomaterials". તથા e-Tender 2018-19-20 "Absorbent Cotton, Gauze Cloth & Bandage Cloth". માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ જેમાં વહીવટી / ટેકનીકલ કારણોસર તા.૦૨-૦૮-૨૦૧૮ **ના રોજ** ઓનલાઇન થઇ શકેલ નથી. **સદર ટેંડરો** તા.૦૬.<u>૦૯.૨૦૧૮ ના રોજથી ઓનલાઇન www.nprocure</u> વેબસાઇટ પર ટેંડર અંગેની સંપૂર્ણ માહિતી જોવાની રહેશે.

ઇ-ટેંડર સુધારો

તબીબી અધિક્ષક

માહિતી-વડો- ૪૪૪/૨૦૧૮-૨૦૧૯ (૫૮૪- સુધારો) એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા

### ધી સંદેશ લીમિટેડ

**રજી. કાર્યાલય** ધી સંદેશ લી. "સંદેશ ભવન", લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામની પાછળ, પી. ઓ. બોડક્દેવ, અમદાવાદ–૩૮૦૦૫૪ (ગુજરાત) • **ટેલી. નં.**: (૦૭૯) ૪૦૦૦૪૦૦૦ ઇમેઇલ : investorsgrievance@sandesh.com and cs@sandesh.co

#### **હપમી વાર્ષિક સામાન્ય સભા, ઈ-વોટિંગ જાણકારી અંગેની** નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે, ધી સંદેશ લિમિટેડની ૭૫મી વાર્ષિક સામાન્ય સભા, શુક્રવાર, ૨૮-૦૯-૨૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ગુજરાત લો સોસાયટી ઓડીટોરિયમ, જી.એલ.એસ. કોલેજ કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં જણાવ્યા પ્રમાણેના કામકાજો માટે રાખેલ છે.

વાર્ષિક અહેવાલ તથા તેમાં સમાવિષ્ટ વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, જે સભ્યોએ પોતાના ઈ–મેલ આઈડી નોંધાવ્યા છે તેમને ઈલેક્ટ્રોનિક્લી રીતે મોક્લી આપવામાં માવેલ છે. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ કંપનીના નાગાકીય વર્ષ ૨૦૧૭–૧૮ના વાર્ષિક અહેવાલ સાથે બાકીના તમામ સભ્યોને તેમના નોંધાયેલા સરનામે માન્ય કરેલ રીતે મોકલવામાં આવેલ છે, અને તે કંપનીની વેબસાઈટ www.sandesh.com ઉપર ઉપલબ્ધ છે. વાર્ષિક સામાન્ય સભા અંગેની નોટિસ સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડની (સીડીએસએલ) વેબસાઈટ www.evotingindia.com ઉપર પણ ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ ૨૦૧૭–૧૮ના વાર્ષિક અહેવાલ, વાર્ષિક સામાન્ય સભાની નોટિસ અને ઈ-વોટિંગ પદ્ધતિની કાર્ચવાહી ૩૧-૦૮-૨૦૧૮ના રોજ પૂરી થઈ ગયેલ છે. જો કોઈ સભ્યને વાર્ષિક અહેવાલની ભૌતિક કોપીની જરૂર હોય તો તેઓ કંપનીને લેખિતમાં વિનંતી કરીને વિના મૃલ્યે મેળવી શકે છે. કોઈ સભ્ય કે જેને વાર્ષિક અહેવાલ ન મળ્યો હોય અથવા કોઈ રોકાણકાર કે જે વાર્ષિક અહેવાલ રવાના થઈ ગયો હોય પછી સભ્ય બન્યા હોય તો તે કંપનીના સેક્રેટરીયલ ડિપાર્ટમેન્ટને 'સંદેશ ભવન', લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, પી.ઓ. બોડકદેવ, અમદાવાદ– ૩૮૦૦૫૪ અથવા તો investorsgrievance@sandesh.com/ cs@sandesh.com ઉપર સંપર્ક કરીને આ અંગે અરજ્ઞ આપી શકે છે અને તે રૂબરૂમાં અથવા પ્રોક્ષીની નિમણુક કરીને મિટીંગમાં હાજરી આપી શકે છે.

વધુમાં નોટિસ આપવામાં આવે છે કે કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૯૧, કંપની (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૧૦, સેળી (લિસ્ટિંગ જવાબદારીઓ અને જાહેરાતની જરૂરિયાતો) અધિનિયમ, ૨૦૧૫ (લિસ્ટિંગ અધિનિયમ)ના અધિનિયમ ૪૨ પ્રમાણે સભ્યોના ૨જિસ્ટ૨ અને શે૨ ટ્રાન્સફ૨ બુક શુક્રવાર, ૨૧–૦૯–૨૦૧૮થી શુક્રવાર ૨૮–૦૯–૨૦૧૮ (બંને દિવસ સહિત) સુધી બંધ

કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮, કંપની (સંચાલન અને વહીવટ) સુધારેલા નિયમો, ૨૦૧૫ અને લિસ્ટિંગ અદ્યિનિયમના અદ્યિનિયમ ૪૪ પ્રમાણે કંપનીએ સભ્યોને વાર્ષિક સામાન્ય સભાના સ્થળથી દૂર રહીને મત આપવાની વ્યવસ્થા (રીમોર્ટ ઈ–વોટીંગ) માટેની જરૂરી સગવડ સીડીએસએલ સાથે કરી છે. મતદાનની સગવડ વાર્ષિક સામાન્ય સભામાં મતદાન પત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે અને જે સભ્યોએ રીમોર્ટ ઈ–વોટીંગ **દ્વારા મત આપ્યો ન હોય તેં સભ્યો પોતાના અધિકારનો** ઉપયોગ વાર્ષિક સામાન્ય સભામાં કરી શકે છે. રીમોટ ઈ-વોટીંગએ વૈકલ્પિક વ્યવસ્થા છે.

સભ્યો કે જેમના નામ સભ્યોના રજિસ્ટરમાં અને બેનિફિશિયલ ઓનર્સના રજિસ્ટરમાં ડિપોઝીટરીસના દ્વારા કટ ઓફ તારીખ પહેલાં શરૂઆતથી નોંધાયા હશે તેમને રીમોટ ઈ-વોટિંગની સવલત મળશે અથવા વાર્ષિક સામાન્ય સભામાં મતદાન પત્ર દ્વારા મત આપી શકશે. સભ્યો કે જેઓ કટ ઓફ તારીખ પહેલાં કંપનીના સભ્ય ન હોય તેઓએ આ નોટિસ કક્ત જાણકારી માટે સમજવી.

પાત્રતા ધરાવતા સભ્યો કે જેમણે કંપનીના શેરો વાર્ષિક અહેવાલ મોકલયા પછી ખરીદ્યા હોય અને કટ ઓફ ડેટના દિવસે જે સભ્યો શેર ધરાવતા હોય તેવા સભ્યો તેમના યુઝર આઈડી અને પાસવર્ડ માટે કંપનીને જાણ કરી શકે છે.

રીમોટ ઈ-વોટિંગનો સમય મંગળવાર, ૨૫-૦૯-૨૦૧૮ના સવારે ૯-૦૦ વાગે શરૂ થશે અને ગુરુવાર ૨૭-૦૯-૨૦૧૮ના સાંજના ૫-૦૦ વાગે પૂરો થશે. આ સમય દરમ્યાન સભ્યો કે જેઓ તેમના શેર, ભૌતિક રીતે કે ડીમેટમાં, કટ ઓફ ડેટ (૨૧–૦૯– ૨૦૧૮)ના રોજ ધરાવતા હોય તેવા સભ્યો રીમોટ ઈ-વોટીંગ દ્વારા મત આપી શક્શે. જે સભ્યોએ વાર્ષિક સામાન્ય સભા યોજાય તે પહેલાં ઈ-વોટિંગથી મતદાન કરી દીધું હશે તેઓ વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહી શક્શે, પરંતુ ફરીથી મતદાન કરી

સભ્યો, રીમોટ ઈ-વોટીંગ દ્વારા અથવા તો વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહીને, કોઈપણ એક રીતે મત આપી શકશે. જો કોઈ સભ્ય બંને પદ્ધતિથી મત આપશે તો રીમોટ ઈ–વોટીંગ દ્વારા આપેલો મત પ્રવર્તિત ગણાશે.

જો ઈ-વોટિંગ દરમ્યાન કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોય તો તેઓ હેલ્પ વિભાગમાં ક્રીક્વન્ટલી આસ્કડ ક્વેશ્ચન્સ "(FAQs)" અથવા ઈ–વોટિંગ મેન્યુઅલ જે www.evotingindia.com ઉપર ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરી શકે છે અથવા ઈ-મેઈલ દ્વારા helpdesk.evoting@cdslindia.com પર લખીને ઈ–મેલ કરી શકશે. સંપર્ક જાણકારી : નામ : શ્રી રાકેશ દાલવી, હોદ્દો : મેનેજર, સરનામું : એ વિંગ, રપમો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન. એમ. જોષી માર્ગ, લોવર પરેલ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૩. ફોન નં. ૧૮૦૦ ૨૦૦ ૫૫૩૩.

તારીખ : સપ્ટેમ્બર ૧, ૨૦૧૮ **સ્થળ** : અમદાવાદ

શક્શે નહિ.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના આદેશથી ધી સંદેશ લિમિટેડ વતી ધવલ પંડ્યા કંપની સેક્રેટરી

# ઓઢવ સરકારી વસાહતના ભયજનક બ્લોક મામલો મ્યુનિસિપલે પ્રથમ દિવસે પાંચ બ્લોક ભયજનક કહ્યાં, હવે વધી ૧૫ થઇ ગયાં

રવિવારે દુર્ઘટના ઘટી ત્યારે માત્ર બે બ્લોક જ ભયજનક લાગ્યા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ ઓઢવ સરકારી વસાહતના ૮૪ બ્લોકના સ્ટ્રકચર અંગે અંધારામાં છે કે પછી શહેરીજનોને ગુમરાહ કરી રહ્યાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રવિવારે ઓઢવ સરકારી વસાહતના બે બ્લોક ધરાશાઇ થયા હતા ત્યારે એવી જાહેરાત કરી હતી કે, માત્ર બે બ્લોક ભયજનક હતા જેથી નોટિસ આપી દેવાઇ હતી પણ બે દિવસ પછી મ્યુનિ.એ છ બ્લોક જર્જરિત હોવાનું કહી ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી હવે ગઇકાલે ૧૫ બ્લોક ભયજનક

હોવાનું કહી ખાલી કરાવાશે તેમ કહી રહ્યાં છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, રવિવારે દુર્ઘટનાના બે કલાક પહેલા માત્ર બે બ્લોક જ જર્જરિત અને જોખમી હતા તો અઠવાડિયામાં ૧૫ બ્લોક ભયજનક કેવી રીતે થઇ ગયાં ? હજુ વધારે બ્લોક પણ ભયજનક હોઇ શકે છે ?

અમદાવાદ મ્યુનિ. તંત્રમાં કોઇ પણ અધિકારી પોતાની જવાબદારી લેવા તૈયાર ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ઓઢવની સરકારી ઇમારતના બે બ્લોક પડી ચૂક્યા છે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે પણ સાત દિવસ વિત્યાં છતાં નબળી ગુણવત્તાના બાંધકામની તપાસ કરવામાં કોઇ હિંમત દાખવતું નથી. બીજી તરફ રવિવારે બે બ્લોક જ ભયજનક હતા તેને નોટિસ આપી હતી તેમ કહી મ્યુનિ.ના અધિકારી પોતાની વાહવાહી કરતાં થાકતા ન હતા પણ અઠવાડિયામાં તે સંખ્યા વધી ૧૫ બ્લોક ઉપર પહોંચી ગઇ છે તો પહેલા દિવસે જ્યારે ચકાસણી કરાઇ ત્યારે અન્ય ૧૫ બ્લોક પણ ભયજનક છે તેવું કેમ ખ્યાલ ન આવ્યો ? આ અઠવાડિયામાં બીજા ભયજનક ૧૫ બ્લોકમાંથી એકપણ બ્લોક પડી ગયો હોત તો શું તેની જવાબદારી મ્યુનિ.ના અધિકારીઓ સ્વીકારી હોત તે મોટો પ્રશ્ન છે.

# પ્રમુખ, સિનિયર ઉપપ્રમુખ ૩ મહિલાના ઇશારે કામ કરતા થયા જીસીસીઆઇની બિઝનેસ વુમન વિંગમાં એક્ટિવ મહિલાઓને સાઇડ લાઇન કરાઈ

ચેમ્બરની ગરિમા જાળવવાની વાતો કરનારાઓ જ ચેમ્બરની આબરૂ લઈ રહ્યાં છે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)માં બિઝનેસ વુમન વિંગની ચૂટણ રદ થયા પછી નવેસરથી સિલેક્શન કરવાનું હતું.નવા સિલેક્શન માટે ઓનલાઇન ચેંરપર્સન તરીકેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પતિ ગયા પછી ચેમ્બરના હાલના પ્રમુખ જૈમિન વસા,સિનિયર ઉપપ્રમુખ દુર્ગેશ બૂચ સહિતના ઓફિસ બેરરે ત્રણ મહિલાઓના દબાવમાં આવીને જૂના સભ્યોને પાછા લેવાનું નક્કી કરી લેતાં પાછો વિવાદ ઊભો થયો છે. ચેમ્બરમાં વર્ષોથી એક્ટિવ છે તેવી

બિઝનેસ વુમનને લાઇડ ટ્રેક કરીને મહિલા ઉમેદવારો નેહા ભટ્ટ અને ચેમ્બરના નામે બિઝનેસ કરતી મહિલાઓને સ્થાન આપવાનું નક્કી કરી લીધું છે. ચેમ્બરની બિઝનેસ વિંગની ચૂટણી સામે રૂઝાન ખંભાતાઓ વાંધો ઉઠાવતા ચૂટણી રદ કરીને સિલેક્શન કરવાનું નક્કી કર્યું હતું. વિવાદ શાંત થઈ ગયો છે તેવું માનીને ચેમ્બરના પદાધિકારીઓએ પાછલા બારણે નેહા ભક્રને ચેરપર્સન લેવાનું નક્કી કર્યું છે.

ગત મહિને બિઝનેસ વુમન વિંગની ચેરપર્સનની પોસ્ટ માટે એક્ટિવ મહિલા સભ્યોને મેલ કરીને આમંત્રણ આપ્યું હતું. માત્ર બે

ઉવી ચૌહાણે ફોર્મ ભર્યા હતા. અગાઉથી નક્કી કર્યા મુજબ બે ફોર્મ જ આવ્યા હતા. નેહા ભટ્ટની સામે ઉવી ચૌહાણે ફોર્મ ભરતા સિલેક્શન કમિટી સમક્ષ બંનેને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. કમિટીમાં જૈમિન વસા,દુર્ગેશ બૂચ, અંબર પટેલ,ઓફિસ બેરર,બિઝનેસ વુમન વિંગના પૂર્વ ચેરપર્સન શીબાની દેસાઈ હાજર નહીં હોવાથી તેમની ગેરહાજરીમાં સરોજ શર્મા અને ગીષ્મા ત્રિવેદીને બોલાવ્યા હતા. કમિટીના સભ્યોએ માત્ર નાટક જ

# રોજિંદા ૬૭ ફાયરમેનની કાયમી ડ્રાઇવર તરીકે નિમણૂક

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં રોજિંદા કર્મચારી તરીકે ફરજ બજાવતા ફાયર મેન કહો કે, જવાનો પૈકી જેઓ કાર ડ્રાઈવિંગનું લાઈસન્સ

સમયથી ફાયરમેનો દ્વારા કરવામાં આવી રહેલી માંગણીનો પણ અંત આવ્યો છે. રોજિંદા ફાયરમેનોને પ્રતિદિન રૂ.૩૫૦ ધરાવતા હતાં તે પૈકી ૬૭ જવાનોની વેતન મળતું હતું. પરંતુ ડ્રાઈવર તરીકે દ્વારા સુખદ અંત લવાયો છે.

ડ્રાઈવર તરીકે કાયમી નિમણૂક કરવામાં કાયમી કર્મચારીમાં સમાવાતા તેમને આવી છે. આ નિમણૂકોથી છેલ્લા કેટલાંક માસિર પગાર પેટે રૂ.વીસ હજાર મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયરમેનોએ આ અંગે વારંવાર મ્યુનિ.માં રજુઆતોનો દૌર લંબાવ્યો હતો. જેનો મ્યુનિસિપલ કોર્પોરેશન

### બાવીસમાં આઈવીએફથી માતા બન્યા એડવોકેટ શીતલબેન શ્વમવગડવા

પોતાની હિંમત અને ધીરજ, પતિ અને પરિવારનો સાથ અને બાવીશી ફર્ટીલીટી ઈન્સ્ટીટ્યુટની ટેકનોલોજી અને સહકારથી સર્જાયો વિક્રમ

લગ્નના પાંચ વર્ષ બાદ સંતાનપ્રાપ્તિ ન થતા શીતલ અને પ્રણવે તેમના નજીકના કિલનીકમાં બે વખત આઈવીએફ સારવાર કરી પરંતુ સંતાનપ્રાપ્તિ ન થઈ. કાયદા નિષ્ણાત શીતલબેને નકકી કર્યુ કે હવે શ્રેષ્ઠ ફર્ટીલીટી કિલનીકમાં જ સારવાર કરાવીશ માટે અમદાવાદની બાવીશી ફર્ટીલીટી ઈન્સ્ટીટયુટ ખાતે ૨૦૧૨ માં આઈવીએફ સારવાર શરૂ કરી.

બાવીશી ફર્ટીલીટી ઈન્સ્ટીટયુટ ખાતે ૨૨ માં પ્રયત્ને સ્વપ્ન સાકાર થયું. દંપતીને આખરે એક અને તંદુરસ્ત પુત્રી 'પંકિત' અવતરી.

લોકો મને પુછે કે શીતલ આઈવીએફ પ્રયત્ન

પછી તુ કેમ છે ? મારો જવાબ "એકદમ સ્વસ્થ છું. હું જેવી હતી તેવી જ છું. ફકત એક તફાવત છે પહેલા હું નિઃસંતાન મહિલા હતી હવે હું ખુશખુશાલ માં છું"

શીતલબેન કહે છે કે મારા પતિ તેમજ સમગ્ર કુટુંબ ઉપરાંત બાવીશી ફર્ટીલીટી ઈન્સ્ટીટયુટના ડોક્ટર્સે મને સંપૂર્ણ સારવાર દરમ્યાન વિશ્વાસ, માર્ગદર્શન, પ્રેરણા અને હૂંક પૂરી પાડી, ત્યારે મારા માટે આ સફર શકય બની, મારો અનુભવ કહે છે કે આ સારવાર શારીરિક રીતે એટલી તકલીફ દાયક નથી જેટલી લોકો માને છે. માનસિક રીતે ચોકકસ તમારી પરીક્ષા કરે છે પરંતુ જો તમે મનથી મકકમ રહી શકો તો સફળતા

દરેક પતિ દુખી થઈ જાય એ સ્વાભાવિક છે. શકે છે. આટલી લાંબી સારવાર દરમ્યાન આટલા બધા લાગણીના ઉતાર-ચઢાવ, કરતી પત્નીની મુશ્કેલીઓ જોઈને કોઈપણ આપણે કાંઈ નથી કરવું.

અને પરીણામ તો સૌની સામે છે.

પણ સફળતા અપાવી શકે છે.

પ્રણવભાઈ કહે છે પત્નીના દુ:ખથી સારવારમાં ટકી રહેવાથી સફળતા મળી જ

એક જ ફર્ટીલીટી ઈન્સ્ટીટયુટમાં કોઈપણ જાતના બ્રેક વગર સતત રર વખત નિષ્ફળતાઓ, કસુવાવડો વગેરેનો સામનો આઈવીએફ સારવાર ના પ્રયત્નો કર્યા હોય, વારંવાર આઈવીએફ થી હાથમાં આવેલી પતિને એમ થઈ જાય કે રહેવા દે હવે પ્રેગનન્સી ગુમાવવા છતાં સારવાર ચાલુ રાખી હોય અને ૨૨ મા પ્રયત્ને તંદુરસ્ત

પુત્રીનો જન્મ થયો હોય તેવો કદાચ આ विश्वनो प्रथम કિસ્સો હશે.

ડો. પાર્થ બાવીશી કહે છે કે જયારે આપણે तमाम क्षेत्रे ટેકનોલોજી પર આધાર અને વિશ્વાસ રાખીએ ત્યારે ટેકનોલોજી

પરંતુ એમ કહેવાથી સંતાનપ્રાપ્તિની | સફળતા આપી શકે તેમ હોય તો પણ લાભ ઈચ્છા પુરી થતી નથી અને અજંપો, દુઃખ, શા માટે નહી લેવાનો ? આજે આધુનિક નિરાશા વગેરે લાગણીઓ કાયમ જ રહે છે. ટેકનોલોજીની મદદથી તમામ યુગલ લગભગ એના કરતા પત્નીને સાથ સહકાર ૧૦૦% સંતાનપ્રાપ્તિ કરી શકે તેમ છે.

આપવાથી એની પણ હિંમત ટકી રહે છે ડો. જાનકી બાવીશી જણાવે છે કે દરેક યુગલને ખબર જ હોય છે કે તેઓ બાળક ડો.ફાલ્ગુની બાવીશી એ જણાવ્યું કે દતક લઈ શકે છે પરંતુ પોતાનું બાળક લેટેસ્ટ ટેકનોલોજી અને તેનો સફળ ઉપયોગ મેળવવાનો અહેસાસ કાંઈક અલગ જ હોય કરનાર તજજ્ઞો ઉપરાંત સમગ્ર ટીમ નો છે. શીતલબેન માં નામ તેવા ગુણ છે એવું લાગણીશીલ તેમજ આત્મીયતાપૂર્ણ તેમણે પુરવાર કર્યું છે, શીતલબેન ફક્ત વ્યવહાર મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં નિઃસંતાન યુગલો માટે જ નહી પણ ફર્ટીલીટી ટ્રીટમેન્ટ પુરી પાડતા લોકો માટે ડો. હિમાંશુ બાવીશી કહે છે કે સામાન્ય પણ પ્રેરણાદાયી છે. તે પુરવાર કરે છે કે રીતે ર થી ૩ સારવાર માં મોટા ભાગના મન હોય તો માળવે જવાય'. જે લડે છે તે યુગલને સંતાનપ્રાપ્તિ થઈ જાય છે પરંતુ જીતે છે. કયારેક વધારે મુશ્કેલી પડે તો પણ

1+1 વર્ષની વૉરંટી

**SONY** KLV40R352F 40 (101.6cm) LED TV

5ાઉલ પેમેન્ટ₹1 | ઇએમઆઇ ₹5,110 X 9 મહિના

MRP ₹ 47,900

SONY

**V37** ₹45,990

SAMSUNG J8 (4GB+64GB)

• એન્ડ્રॉઇડ OS, v8.0 (ઓરિયો)

• 1.8GHz ઑકટા-કોર પ્રોસેસર

• 16MP+ 5MP રિઅર કૅમેરા

**V**377 ₹ 17,990

LG GLI292RPZL

260 L

• સ્માર્ટ ઇન્વર્ટર કમ્પ્રેસર

• સ્માર્ટ ડાયગ્નોસીસ સિસ્ટમ

ย์એમઆઇ ₹2,167 X 12 भिहला

• આઈસ બીમ કોર ફૂલિંગ

धन्डीनीटी डिस्प्ले

• 6 (15.24cm) HD สนุร AMOLED

• 16MP ਵੰਟ કੌਮੇਦਾ • 3500mAh બૅਟਵੀ

ઈએમઆઈ ₹1,799 X 10 મહિના

4G Style Rey VOLTE OO SHORE HER

કાશ્મીરના પહાડ પરથી ધક્કો મારવાનો ઓડિયો વાઈરલ

# જામનગરના પૂર્વ સાંસદ વિરુદ્ધ ખૂનના કાવતરાની પુત્રવધૂની પોલીસ ફરિયાદ

જામનગરના પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તેમજ તેના બે દિકરા અને ચંદ્રેશભાઈના પીએ સામે ચંદ્રેશભાઈના પુત્રવધુએ હત્યાનું કાવતરૂ ઘડતા હોવાની ચોકાવનારી ફરિયાદ નોંધાવી છે.

ગત ૪થી જુલાઈના રોજ કરવામાં આવેલી આ ફરિયાદ અરજી પરથી પોલીસે હજુ આજની તારીખ સુધી કોઈ પગલા લીધા નથી. બીજી તરફ ફરિયાદી પુત્રવધુના આક્ષેપોને પુર્વ સાંસદ નકારીને છેલ્લા બે મહિનામાં તેઓએ સામી પોલીસ અરજી તેમજ પુત્રવધુને છુટાછેડાની નોટીસ આપી હોવાનું જણાવ્યું છે. એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાબેને પૂર્વ સાંસદના પુત્ર હીતેશભાઈ કોરડીયા(પટેલ)સાથે ૨૦૦૧માં પ્રેમ લગ્ન કર્યા હતાં. બાદમાં પુર્વ સાંસદને આ લગ્ન પસંદ ન હોવાથી લાંબા સમય બાદ સમાધાન થયું હતું. હાલ દિવ્યાબેને પુર્વ સાંસદ અને જામનગર જીલ્લા કરવામાં આવ્યો છે.


ભાજપા પ્રમુખ ચંદ્રેશભાઈ વાલજીભાઈ કોરડીયા, તેના બે પુત્રો હીતેશ અને વિપુલ તેમજ પીએ મુકુંદભાઈ સભાયા સામે તા.૪/૭/૧૮ના રોજ ફરિયાદ અરજી સાથે એક ઓડીયો કલીપ આપી પોતાની પોતાની હત્યાનું કાવતરૂ થતું હોવાની રજૂઆત પોલીસને કરી છે. પોતાની હત્યાના કાવતરાના ભાગરૂપે ગત મે માસની તા.ર૦થી ૩૧ સુધી દિલ્લીથી હરદ્વાર, ઋષિકેશ વગેરે સ્થળે લઈ જવામાં આવી હોવાનું અને દરમ્યાનમાં પોતે બીમાર થતાં બચી ગઈ હોવાનો આક્ષેપ કરી પોતાના પતિને શરાબનું વ્યસન હોવાનો આક્ષેપ કરી પરિવારની આબરૂને ખાતર ચુપ જામનગરમાં હાથી કોલોનીમાં ઓમકાર બેઠી હોવાનું અરજીમાં જણાવી. સુરક્ષાની માંગણી પણ કરી છે. કથિત ઓડીયો કલીપમાં જમ્મુ કાશ્મીર તરફ લઈ જઈ પહાડ પરથી ધક્કો મારવા, ઘેનની વધારે ગોળી આપી દેવા, ઘઉંમાં નાંખવાના ટીકડાનો ઉપયોગ કરવા જેવી બાબતોનો ઉલ્લેખ પણ

# એક કા તીન કૌભાંડનું ભૂત ૭ વર્ષે ફરી ધૂણ્યું આલિયા એન્ટરપ્રાઇઝ તેમજ સન્સ કન્સલ્ટન્સીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ

આલિયા એન્ટરપ્રાઇઝ અને સન્સ કન્સલ્ટન્સીના સંચાલક રાજા સૈયદે લોકોને એક કા તીન કરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે તે વખતે જુદા-જુદા પોલીસસ્ટેશન અને સીઆઇડી ક્રાઇ મમાં રાજા સૈયદ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી. બોમ્બે મર્કેન્ટાઇન કો.ઓ. બેન્કની કેશિયર મહિલાએ પણ રાજા સૈયદે લાલચ આપતાં ૨૦૧૧માં ૪ લાખ રૂયિયાનું રોકાણ કર્યું હતુ. પરંતુ ૭ વર્ષબાદ પણ પૈસા પરત આપ્યા નહોતા. જેના કારણે મહિલા વારંવાર ઉઘરાણી કરતી હતી. જેથી રાજાએ તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસસ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજા સૈયદના પિતા નિઝામ સૈયદ અગાઉ ક્રાઇ મબ્રાંચમાં એએસઆઇ હતા.

જુહાપુરામાં ગુલમહોર સોસાયટીમાં રહેતા સરતાજ જહાં ખુરશીદખાનજી મલિક (ઉ.વપ૨) રિલીફ રોડ ખાતેની બોમ્બે મર્કેન્ટાઇન કો.ઓ બેન્કમાં હેડ કેશિયર તરીકે નોકરી કરે છે. તેમના સબંધી નિઝામુદ્દીન સૈયદ છે. જે અગાઉ ક્રાઇ મબ્રાંચમાં એએસઆઇ તરીકે નોકરી કરતો હતો. હાલ તે નિવૃત્ત થઈ ગયા છે. તેમનો પુત્ર કુતુબુદ્દીન ઉર્ફે રાજા સૈયદે ( ઉ.વ ૩૫) લોકોને એક કા તીનની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સરતાજ જહાંને પણ રાજાએ સમજાવીને ૨૨માર્ચ ૨૦૧૧માં ૩ લાખ રૂપિયા અને પ ડિસેમ્બર ૨૦૧૧માં ૧ લાખ મળીને કુલ ૪ લાખ રૂપિયાનું રોકાણ રાજાની આલિયા એન્ટરપ્રાઇઝ અને સન્સ કન્સલ્ટન્સી નામની કંપનીઓમાં રોકાણ કરાવડાવ્યું હતું. તેની રસીદો પણ તેમની પાસે છે. અનેકવાર સરતાજ જહાંએ રાજાના ઘરે જઈને પણ ઉઘરાણી કરી હતી. રાજા દરેક વખત વાયદા કરતો હતો.

પૈસા પરત ના આપવા પડે એટલે જાનથી મારી નાખવાની ધમકી





## **DOWN PAYMEN** तमारा मनपसंद र्धसे<del>ड्ट्रॉनिड्</del>स पर બાકીની રકમ સરળ હપ્તાઓમાં

IFB Serena Aqua SX Front-Load Washing Machine



MRP ₹ 30,690 **બચત કરો** 

**₹ 26,000** ₹4,690

• ઍકવા એનર્જી • 2D વૉશ સિસ્ટમ • ि्रसेंट भून इम • ऑस वॅस्व टैडनोसॉक्ट • ऑटो ॲसन्स सिस्टम ત્રીરો કાઉન પેમેન્ટ ઇએમઆઇ ₹3,749 X 8 મહિના

> MRP ₹ 31,790 | બચત કરો ¥29,990 ₹1,800

BAJAJ CHET ઑફર્સ ઉપલબ્ધ

R3 મૉલ : માનવ મંદિરની સામે, ડ્રાઇવ-ઇન રોડ



AHMEDABAD SURAT VADODARA MUMBAI PUNE DELHI GURGAON NOIDA INDIRAPURAM FARIDABAD બમારા શોરુમની મુલાકાત લો : આશ્રમ રોડ : ૨૮૦ બિઝનેસ સ્કવેર, એચ. કે. કૉલેજની સામે સી. જી.: 3rd આય વન, હેવમોટ રેસ્ટોરેન્ટની સામે. માટી નગર: ચાર રસ્તા, કૃષ્ણ બાગ દેવ આર્ક મૉલ: ઇસ્કેન કૉસ રોડ, એસ. જી. હાઇધ ચાંદખેડા : સિગમા ઑર્કેડ, ગ્રાઉન્ડ ક્લોર, ONGC પાસે, મેઠસાણા રો

કુપણ નગર : શોપ ને 1, 2, 3, ગ્રાઉન્ડ ફરીર, મારૂતી પતાર્ઝા, વિજય પાક BRTS બસ સ્ટેંડ સામે શા**ક્ષિનાગ :** સુમેલ-11, ઈન્કિયન ટેક્સટાઈલ પલાઝા, જહાંગીર મિલ કમ્પાઉંક,

ઓઢ્ય : કઠાન શૉપ નં 3 - 10. ઠૉટેલ સકારીની સામે. ગિરિવર પ્રાઇડની બાજુમાં, એસ.પી. રિંગ રોડ **રખિયાલ** : સુમેલ-8, અજિત મિલ AMTS બસ સ્ટોપ પાસે, યશ પ્લાઝા સામે. રખિયાલ રોડ

સંસ્થાકિચ /જથ્થાબંધ પૂછપરછ માટે, ઈમેલ કરો:corporate@vijaysales.com • V CARE AHMEDABAD: (079) 6604 3333 | www.vijaysales.com \*શસ્તો લાગુ. આ ઑકરના લાભ ક્કત અમદાયાદ, સુરત, વડોદરા, મુંબઇ, નવી મુંબઇ, મીરા રોક, દ્યારો, પત્નેપર, પૂછે, હિલ્લી, ગુકગાવ, નોઇકા, ઇંદિરાપુરમ અને કરિદાબાદ ખાતે મેળવી શકાશે. વધુ માહિતી માટે અમારા શોરૂમની મુલાકાત રેવી. આ ઑકર બાકી બધી છૂટોને આવશે ચુંકત છે. બીજી કોઈપણ ઑકરનો સાથે જોકી શકાશે નહીં. દર્શવિલ ચિત્રો કકત ક્રષ્ટાંતરૂપે છે. પ્રોરોસિંગ કી બજાજ કાઇનાબસના અથ્યા કેપિટલ ફર્સ્ટ નિયમનુસાર લાગુ. ઑકર સ્ટાંક શ્લે ત્યા સુધી. કાઇનાબસ ઑકર સંપૂર્ણપણ બજાજ કાઇનાબસ લિમિટેડ અથ્યા કેપિટલ ફર્સ્ટ લિમિટેડના નિર્ણયને આધીન. આપના કેડિટ કાર્ડ, ચેક્સ, 1 ફોટોગ્રાફ, રહેલાઓ પુરાવો અને ફોટો ઓળખ સાથે લાવવા વિનંતી. ઝીરો કાઉન પેમેન્ટ ઑકર માત્ર ચુર્નદા બ્રાન્ડ્સ અને મોડેલ્સ પર જ લાગુ.





